



**NU-7851**

Seat No. \_\_\_\_\_

**Third Year B. Com. (Non CBCS) Examination**  
**February – 2017**  
**Compulsory Statistics**

Time : 3 Hours]

[Total Marks : 100

- સૂચના :** (1) બધા જ પ્રક્રિયાના ગુણ સમાન છે.  
(2) જમણી બાજુ ગુણ દર્શાવેલ છે.  
(3) ગ્રાફ પેપર્સ વિનંતીથી આપવામાં આવશે.

- 1** (અ) સંભાવનાનો સરવાળાનો નિયમ લખો અને સાબિત કરો. **8**  
(બ) જો  $P(A) = 0.7$ ,  $P(B) = 0.6$  અને  $P(A \cap B) = 0.56$  **6**  
હોય તો  
(i)  $P(A' \cap B')$   
(ii)  $P(A' \cup B')$   
(iii)  $P(A'/B')$  શોધો.  
(ક) એક પેટીમાં 6 કાળા અને 4 સફેદ દડા છે તેમાંથી 2 દડા યદૃચ્છ રીતે **6**  
લેવામાં આવે તો  
(i) બંને દડા કાળા હોવાની  
(ii) બંને દડા સફેદ હોવાની  
(iii) બંને દડા જુદા-જુદા રંગના હોવાની સંભાવના શોધો.

**અથવા**

- 1** (અ) પોયસન વિતરણના ગુણાધર્મો અને ઉપયોગો જણાવો. **8**  
(બ) એક યદૃચ્છ ચલ  $x$  નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે :

$x:$	0	1	2	3	4
$p(x):$	0.10	$k$	0.30	$k$	0.10

શોધો :

- (i)  $K$   
(ii)  $E(x)$   
(iii)  $V(x)$

(ક) આઠ સિક્કાઓ એકી સાથે ઉછાળવામાં આવે છે બતાવો કે ઓછામાં 6

ઓછી છ છાપ મેળવવાની સંભાવના  $\frac{37}{256}$  છે.

2 (અ) સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત સમજાવો. 8

(બ) નીચે આપેલ માહિતી પરથી સહસંબંધાંક શોધો : 12

$x \backslash y$	10-20	20-30	30-40	40-50	50-60
20-30	3	2	3	-	-
30-40	-	5	9	6	-
40-50	-	2	4	3	3

અથવા

2 (અ) નિયતસંબંધાંકોની વ્યાખ્યા આપો. તેના ગુણવર્મા જણાવો. 8

(બ) બે નિયતસંબંધ રેખાઓ  $x + 2y - 5 = 0$  અને 12

$$2x + 3y - 8 = 0 \text{ છે. } \sigma_x^2 = 12 \text{ હોય તો } \bar{x}, \bar{y}, \sigma_y^2 \text{ અને } r \text{ શોધો.}$$

3 (અ) સરળ યદ્દર્શ નિર્દર્શન પદ્ધતિ અને સ્તરિત યદ્દર્શ નિર્દર્શન પદ્ધતિ સમજાવો. 10

(બ) એક સમાચિના અવલોકનો 3, 5, 7, 9, 11 છે. તેમાંની 2 કદના શક્ય 10 તમામ યાદચિક નિર્દર્શો પુરવણી રહિત નિર્દર્શન દ્વારા મેળવો.  
નીચેના પરિષાભો તપાસો :

$$(i) E(\bar{y}) = \bar{y}$$

$$(ii) V(\bar{y}) = \left[ \frac{N-n}{Nn} \right] S^2.$$

અથવા

3 (અ) સમાંતર અને સમગુણોત્તર શ્રેષ્ઠીની વ્યાખ્યા સમજાવો બંને શ્રેષ્ઠી માટે  $T_n$  અને  $S_n$ ના સૂત્રો મેળવો. 10

(બ)  $5 + 55 + 555 \dots\dots$  ના પ્રથમ  $n$  પદોનો સરવાળો શોધો. 5

(ક) એક સમાંતર શ્રેષ્ઠીના પ્રથમ 12 પદોનો સરવાળો 28 અને 5  
પ્રથમ 28 પદોનો સરવાળો 12 હોય તો આ શ્રેષ્ઠીના પ્રથમ 40 પદોનો  
સરવાળો શોધો.

- 4 (અ) જીવનનિર્વાહના સૂચકાંક પર ટૂક નોંધ લખો. 8  
 (બ) નીચે આપેલી માહિતી પરથી  $I_L$ ,  $I_P$ ,  $I_F$ ,  $I_{D.B.}$ , અને  $I_{\mu E}$  શોધો. 12

વસ્તુઓ	આધાર વર્ષ		ચાલુ વર્ષ	
	કિંમત	જથ્થો	કિંમત	જથ્થો
A	5	10	10	15
B	9	12	12	7
C	12	18	15	15
D	10	5	12	6
E	6	6	18	10

અથવા

- 4 (અ) નીચેના પદો સમજાવો : 8  
 (i) હેતુલક્ષી વિધેય  
 (ii) બાધકો  
 (iii) ઈષ્ટતમ ઉકેલ  
 (iv) વધ અને ઘટ ચલ.  
 (બ) નીચે આપેલ માહિતી પરથી આલેખની રીતથી સુરેખ આયોજન પ્રશ્નનો ઉકેલ શોધો : 6  
 If  $2x + y \leq 40$ ,  $2x + 5y \leq 120$ ,  $x, y \geq 0$  શરતોને આધીન  
 $Z = 3x + 4y$ ની કિંમત મહત્તમ થાય તે રીતે  $x$  અને  $y$ ની કિંમત શોધો.  
 (ક) એક પ્રમાણ્ય વિતરણ માટે પ્રથમ ચતુર્થક 73 અને પ્ર. વિ. 15 છે તો 6  
 (i) મધ્યस્થ  
 (ii) ચતુર્થક વિચલન  
 (iii) સરેરાશ વિચલન શોધો.
- 5 (અ) ધંધાકીય પૂર્વનુમાન એટલે શું ? ધંધાકીય પૂર્વનુમાન માટે ઉપયોગમાં લેવાની મુખ્ય રીતો સમજાવો. 10  
 (બ) નીચેની માહિતી માટે દ્વિધાતી પરવલય વકનું અન્વાયોજન કરો અને વર્ષ 2017ની કિંમતનું આગાશન કરો.

વર્ષ :	2011	2012	2013	2014	2015
કિંમત :	7	9	10	13	18

અથવા

- 5 (અ) ગુજરાત્મક સંબંધનો અર્થ સમજાવો અને તેના પ્રકારો સમજાવો. **10**  
 (બ) નીચેની માહિતી પરથી  $Q$  અને  $y$  મેળવો અને  $Q = \frac{2y}{1+y^2}$  ચકાસો : **10**  
 $N = 200, (B) = 107, (\alpha) = 100, (\alpha \beta) = 51.$

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions carry equal marks.  
 (2) Marks are indicated on right side.  
 (3) Graph papers will be given on request.

- 1 (a) State and prove addition law of probability. **8**  
 (b) If  $P(A) = 0.7, P(B) = 0.6$  and  $P(A \cap B) = 0.56$  then **6**  
 find  
 (i)  $P(A' \cap B')$   
 (ii)  $P(A' \cup B')$   
 (iii)  $P(A'/B')$   
 (c) A box contains 6 black and 4 white balls two balls **6**  
 are taken at random from it. Find the probability that  
 (i) both balls are black  
 (ii) both balls are white  
 (iii) both balls are of different colours.

**OR**

- 1 (a) State the uses and the properties of a Poisson distribution. **8**  
 (b) Prob. distribution of a r.v.  $x$  is as follows : **6**

$x:$	0	1	2	3	4
$p(x):$	0.10	$k$	0.30	$k$	0.10

Find :

- (i)  $K$
- (ii)  $E(x)$
- (iii)  $V(x)$

(c) Eight coins are thrown simultaneously. Show that 6

the prob. of getting at least six heads is  $\frac{37}{256}$

- 2** (a) Explain the correlation coefficient method of Spearman. 8  
 (b) Find the correlation coefficient from the following 12  
 data :

$x \backslash y$	10-20	20-30	30-40	40-50	50-60
20-30	3	2	3	-	-
30-40	-	5	9	6	-
40-50	-	2	4	3	3

**OR**

- 2** (a) Define regression coefficients. State its properties. 8  
 (b)  $x + 2y - 5 = 0$  and  $2x + 3y - 8 = 0$  are the two 12  
 regression line equations.  $\sigma_x^2 = 12$  then find out

$$\bar{x}, \bar{y}, \sigma_y^2 \text{ and } r.$$

- 3** (a) Explain simple random sampling method and 10  
 stratified random sampling method.

- (b) 3, 5, 7, 9, 11 are observations of a population. 10  
 Obtain all possible samples of size 2 without  
 replacement. Verify the following results.

$$(i) E(\bar{y}) = \bar{y}$$

$$(ii) V(\bar{y}) = \left[ \frac{N-n}{Nn} \right] S^2.$$

**OR**

- 3** (a) Explain the definition of A.P. and G.P. also 10  
 obtain its formula for  $T_n$  and  $S_n$ .

- (b) 5 + 55 + 555 ..... find sum of first n terms. 5

- (c) Sum of first 12 terms of an A.P. is 28 and the sum 5  
 of its first 28 terms is 12. Find the sum of its  
 first 40 terms.

- 4 (a) Write short note on cost of living index number. 8  
 (b) Find  $I_L$ ,  $I_P$ ,  $I_F$ ,  $I_{D.B.}$ ,  $I_{\mu.E}$  from the following data. 12

Commodities	Base Year		Current Year	
	Price	Quantity	Price	Quantity
A	5	10	10	15
B	9	12	12	7
C	12	18	15	15
D	10	5	12	6
E	6	6	18	10

### OR

- 4 (a) Explain the following terms : 8  
 (i) Objective function  
 (ii) Constraints  
 (iii) Optimum solution  
 (iv) Slack and Surplus Variable  
 (b) Solve the following LPP by using graphical method. 6  
 If  $2x + y \leq 40$ ,  $2x + 5y \leq 120$  then obtain the values of  $x$  and  $y$  maximize  $Z = 3x + 4y$ .  
 (c) For a normal distribution first quartile = 73 and 6  
 S.D. = 15. Find  
 (i) Medium  
 (ii) Quartile deviation  
 (iii) Mean deviation.
- 5 (a) What is meant by business forecasting ? Explain 10  
 the methods used in business forecasting.  
 (b) Fit the second degree curve to the following data 10  
 and estimate the price of the year 2017.

Year :	2011	2012	2013	2014	2015
Price :	7	9	10	13	18

### OR

- 5**    (a) Explain the meaning of association and its type.      **10**  
      (b) From the following data obtain  $Q$  and  $y$  and      **10**

verify that  $Q = \frac{2y}{1+y^2}$

$N = 200, (B) = 107, (\alpha) = 100, (\alpha \beta) = 51.$

---